

રાજકોટ રૂરલ જિલ્લા :- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- માર્ચ/૨૦૧૯

- (૧) તા.૦૬/૦૩/૨૦૧૯ ના રોજ પડધરી પો.સ્ટે. વિસ્તારમાં ના.રા. દરમ્યાન ખાનગી રાહે મળેલ હકિકત આધારે (૧) વેચલો ઉર્ફે જુવાન સેકડીયાભાઈ કનાસ ઉ.વ.૩૧ તથા (૨) માધુ દુઠીયાભાઈ બામણીયા ઉ.વ.૨૨ તથા (૩) લખમણ અજમાભાઈ કનાસ ઉ.વ.૩૦ તથા (૪) રાજન જંગલાભાઈ ચૌહાણ ઉ.વ.૨૪ તથા (૫) રાજેશ ઉર્ફે રાજુ રતુભાઈ કનાસ ઉ.વ.૨૪ રહે. બધા- હાલ- પડધરી ભારત હોટલ પાછળ, મુળ.મધ્યપ્રદેશ વાળાઓ ધાતક હથિયારો કુહાડી કિ.રૂ.૫૦/- તથા લોખંડનું ધારીયુ કિ.રૂ.૧૦૦/- તથા લાકડાના હાથા વાળુ ધારીયુ કિ.રૂ.૫૦/- તથા અણીદાર પથ્થર ભરેલ થેલી કિ.રૂ.૦૦/- તથા લોખંડની ખીલાસરી બાંધેલ લાકડાની સોટી કિ.રૂ.૦૦/- જે હથિયારો કોઈ પણ પ્રકાર ની મિલકત મેળવવા માટે ધાડ પાડવાના ઉપયોગમાં આવી શકે તેવા હોય. તથા ચાર્જીંગ બેટરી કિ.રૂ.૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૧૧,૫૦૦/- મળી કુલ રૂ.૧૧,૮૦૦/- ના મુદામાલ સાથે, રાજકોટ જામનગર નેશનલ હાઇ-વે રોડ ઉપર આવતા જતા વાહનો ના ટાયરોમાં લોખંડની ખીલાસરી તથા અણીદાર પથ્થરો થી પંચર પાડી વાહનો રોકાવી વાહનમાં બેઠેલ માણસો પાસેથી જે કોઈ મિલકત મળી આવે તેની લુંટ કરવાના ઇરાદે, ધાડ પાડવાની તૈયારી સાથે, મળી આવતા તમામને અટક કરી શ્રી સરકાર તરફે ફરીયાદ આપી પડધરી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૦/૧૯ ઇ.પી.કો. ક. ૩૯૯, ૪૦૨ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
- (૨) તા.૧૮/૧૧/૨૦૧૮ ના રોજ ગોંડલ તાલુકા પો.સ્ટે.માં ફરીયાદીશ્રી ગંગાબેન સોમાભાઈ બગડા જાતે.અનુજાતિ ઉ.વ.૬૫ ધંધો.નિવૃત્ત રહે.ભોજપરા જુનાગામ તા.ગોંડલ વાળાએ તેઓની ફરીયાદ જાહેર કરેલ કે, તા.૧૭/૧૧/૧૮ ના રોજ કોઈ અજાણ્યા માણસે ફરીયાદીને છરી વડે ડાબા હાથના કાંડા ઉપર ઇજા કરી ફરીયાદીનો સેમસંગ કંપીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦૫૦/- નો લુંટ કરી લઈ ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરતા ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૪૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૯૪, ૪૫૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો જાહેર થયેલ છે જે ગુન્હો વણશોધાયેલ હોય અને ગઈ તા.૨૦/૦૩/૨૦૧૯ ના રોજ વાહન ચેકીંગ દરમ્યાન ગોંડલ તાલુકા પો.સ્ટે. ના ગોમડા ચોકડી નેશનલ હાઇ-વે રોડ ઉપર થી નરશીભાઈ દામજીભાઈ રાહોડ જાતે.દેવીપુજક ઉ.વ.૩૦ રહે.તાર બંગલા જી.જુનાગઢ વાળાને ઉપરોક્ત સેમસંગ કંપીનો મોબાઇલ ફોન તથા અન્ય બીજા ૦૯ (નવ) મોબાઇલ ફોન મળી કુલ ૧૦ મોબાઇલ ફોન કિ.રૂ. ૬૨૫૦/- સ્પ્લેન્ડર મો.સા. રજી. નંબર- જી.જે.૧૧-ક્યુ. ૯૦૩૭ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૧,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી મુદામાલ તથા આરોપીને ગોંડલ તાલુકા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

(3) તા.૨૯/૦૩/૨૦૧૭ ના રોજ ફરીયાદીશ્રી મનસુખભાઈ જીવરાજભાઈ અકબરી જાતે.પટેલ ઉ.વ. રહે.પાટી રામપર તા.પડધરી વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાના પુત્ર મરણ જનાર કપીલ મનસુખભાઈ અકબરી રહે.પાટી રામપર તા.પડધરી વાળાને કોઈ અજાણ્યા ઇસમે તેનું મોત નિપજાવવાના ઇરાદે માથાના ભાગે કોઈ હથિયારથી ઇજા કરી સારવાર દરમ્યાન તેનું મોત નિપજાવેલ છે. જે બાબતે પડધરી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૦૨ મુજબનો ગુન્હો જાહેર થયેલ હતો. જે ગુન્હો વણશોધાયેલહોય હોય અને આ ગુન્હાની તપાસ દરમ્યાન મરણ જનાર કપીલ નો સેમસંગ કંપીનો જે-૦૭ મોબાઇલ જેના IMEI No. 352347089288020 નો મળી આવેલ ન હોય અને તે ફોન આરોપી સાથે લઇ ગયેલ હોય તેવી શક્યતા હોય અને તે ફોન ચાલુ થતા તે ફોન રતનભાઈ મકનભાઈ બામણીયા જાતે.આદીવાસી રહે.લીંબડી તા.સંતરામપુર જી.મહીસાગર વાળા પાસે હોવાની માહિતી મળતા જે બાબતે પેરોલ ફર્લો પો.સ.ઇ.શ્રી એન.વી.હરીયાણીનાઓએ સુચના કરતા તેઓએ આરોપીની તપાસ કરતા આરોપી રતનભાઈ મકનભાઈ બામણીયા જાતે.આદીવાસી રહે.લીંબડી તા.સંતરામપુર જી.મહીસાગર વાળો મળી આવતા તેની પુછપરછ કરતા પોતે મરણ જનારનું ખુન કરેલ હોવાની તેમજ આરોપી પાસેથી મરણ જનારનો ફોન મળી આવેલ જે આરોપી પોતે સાથે લઇ ગયેલ હોવાની હકીકત જણાવતા આરોપી તથા મુદામાલ મોબાઇલ ફોન પડધરી પો.સ્ટે. સોંપી આપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો દ્વારા સચુંકત રીતે કામગીરી કરી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.
